K.Z. LEASING & FINANCE LTD.

REGD. OFFICE: DESHNA CHAMBERS, H/H. KADVA PATIDAR VADI, USMANPURA, ASHRAM ROAD, AHMEDABAD-380014.(GUJARAT) PHONE: 079-27543200 CIN L 65910 GJ 1986 PLC 008864

13th August, 2024.

To,
The Deputy Manager,
Department of Corporate Services,
Bombay Stock Exchange Limited
Dalal Street, Fort
Mumbai - 400 001.

BSE Company Code: 511728

Dear Sir.

Sub.: Newspaper Advertisement of Financial Results for the Quarter ended 30th June, 2024.

Ref.: Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirement)
Regulations, 2015

As per the reference above, we hereby submit you the Newspaper copy of the Financial results for the quarterended on 30.06.2024, as published in the Newspaper in English as well as Gujarati.

Kindly take note of the same.

Thanking you,

Yours Faithfully,

For, K Z LEASING AND FINANCE LIMITED

ANKIT PRAVINKUMAR PATEL Digitally agreed by ANDET FRANKILLUMAR FATTLE
DIGITAL TO DESCRIPTION OF THE STATE O

ANKIT P PATEL Director, CFO (Din: 02901371)

THE RAMESHWARA JUTE MILLS LIMITED

CIN: L17119WB1935PLC046111 Regd.Office: 9/1, R. N. Mukherjee Road, Kolkata - 700 001 Telephone No.: 033-2243 5453

e-Mail: rjm.ho@rjm.co.in; Website: www.rameshwarajute.com

Extract of statement of Unaudited Financial Results for the quarter ended on 30.06. 2024 approved by the Board of Directors on 12.08.2024

(₹ in Lakh							
SI. No.	Particulars	Three months ended	Previous Three months ended 31.03.2024	Corresponding Three months ended in previous year 30.06.2023	Year to date figures for the previous period ended 31.03.2024		
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)		
1	Total income from operations(net)	2.85	2.71	2.85	11.40		
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(60.12)	(69.42)	(50.74)	(308.00)		
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(60.12)	(69.42)	(50.74)	(308.00)		
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(60.12)	(42.30)	(50.74)	(280.88)		
5	Total Comprehensive Income for the period [Comprehensive Profit and (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	227.86	(30.58)	68.90	(34.57)		
6	Equity Share Capital	26.61	26.61	26.61	26.61		
7	Reserve (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	_		8,126.39		
8	Earnings per equity share (of ₹ 10 each) (not annualised) 1. Basic	(22.59)	(15.90)	(19.07)	(105.57)		
0 0	2. Diluted	(22.59)	(15.90)	(19.07)	(105.57)		

Date: 12.08.2024

EXTR#

- a) The above is an extract of the detailed format of quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirments) Regulations, 2015. The full format of the quarterly Financial Results are available on the website of the Calcutta Stock Exchange Limited at www.cse-india.com and on company's website at : http://rameshwarajute.com/quartarly_results.php
- b) There are no Exceptional and /or Extraordinary items adjusted in the Statement of Unaudited Financial Results for the quarter ended 30.06.2024 in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015.

For The Rameshwara Jute Mills Limited

DIN - 00869222

SAMPANN UTPADAN INDIA LIMITED

(Formerly Known as S. E. Power Limited)

CIN: L40106GJ2010PLC091880

Tel.: +91 2667 251566, E-mail: cs@sepower.in, Website: www.sepower.in
ACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2024

	(₹ in Lacs except EPS					
Γ	Quarter Ended				Year Ended	
	Particulars		31.03.2024	30.06.2023	31.03.2024	
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	
R	evenue from operations	2019.34	1908.90	1751.82	7145.33	
	let Profit for the period pefore Tax, Exceptional and/or Extraordinary Items)	(205.57)	85.87	(130.70)	(88.45)	
	et Profit for the period before Tax after Exceptional and/or Extraordinary Items)	(205.57)	85.87	(130.70)	(88.45)	
Ν	et Profit for the period after tax	(154.01)	43.95	(97.90)	(86.78)	
[0	otal Comprehensive Income for the period Comprising Profit/(Loss) for the period (after tax) nd Other Comprehensive Income (after tax)]	(154.01)	43.95	(97.90)	(86.78)	
	aid up Equity Share Capital Face value of Rs. 10/- per share)	4061.00	4061.00	4061.00	4061.00	
	eserves excluding Revaluation Reserves as per balance sheet of previous accounting Year)	_	-	_	(3545.15)	
	arnings per Share (of Rs. 10 each) (not annualised) asic & Diluted:	(0.38)	0.11	(0.24)	(0.21)	

1) The key standalone financial information of the Company is as under:

		Year Ended		
Particulars	30.06.2024	31.03.2024	30.06.2023	31.03.2024
	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)
Revenue from operations	2019.34	1908.90	1751.82	7145.33
Profit before tax	(205.30)	(86.35)	(130.43)	(87.13)
Profit after tax	(153.79)	44.64	(97.60)	(85.28)

2) The above is an extract of the detailed Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results (Consolidated/Standalone) are available on the website i.e. www.sepower.in and on the Stock Exchanges' websites i.e. www.bseindia.com and www.nseindia.com.

Place : Vadodara : 12.08.2024 For and on behalf of Board of Directors

(SACHIN AGARWAL) Managing Director

aban

ABAN OFFSHORE LIMITED

Regd. Office: "Janpriya Crest", 113, Pantheon Road, Egmore, Chennal - 600 008. Ite: www.abanoffshore.com; Tel No.044-49060806; Fax: 044-28195527 CIN:L01119TN1986PLC013473

NOTICE OF 38TH ANNUAL GENERAL MEETING AND **E-VOTING INFORMATION**

Notice is hereby given that the 38th Annual General Meeting ("AGM") of the Shareholders of the Company will be held on Thursday, the 12th September 2024 at 10.15 A.M. IST through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM"). The Annual General Meeting of the Company will be held through Video Conferencing (VC) or other audio visual means (OAVM) as per the guidelines issued by the Ministry of Corporate Affairs (MCA) vide Circular No.14/2020 dated April 8,2020, Circular No.17/2020 dated April 13,2020 Circular No.20/2020 dated May 05,2020 and subsequent circulars issued in this regard, the latest being 09/2023 dated September 25, 2023 and other applicable circulars issued by MCA (collectively referred as MCA circulars). Hence, Members can attend and participate at the ensuing AGM through VC/OAVM.

Notice of the AGM, together with the Annual Report for the financial year 2023-24, have been sent in electronic form on 12th August 2024, in accordance with the relaxation granted by the Securities and Exchange Board of India vide Circular No: SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May 2020 and the subsequent circulars issued in this regard the latest being circular NO: SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated October 07, 2023 to all the shareholders whose names appear on the Register of Members /list of Beneficial Owners as received from National Securities Depository Limited (NSDL)/Central Depository Services (India) Limited (CDSL) as at the close of business hours on **05th September**, **2024** and who have registered their email id with the

Members may note that the Notice of the AGM and Annual Report for the Financial year 2023-24 will also be available on the Company's website at www.abanoffshore.com, website of National Security Depository Limited (NSDL) at www.evoting.nsdl.com, website of BSE Limited at www.bseindla.com and website of the National Stock Exchange of India Limited at www.nseindla.com respectively. The instructions for joining the AGM are provided in the Notice. Members attending the Meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

n Compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with the Companies (Management and Administration) Rules, 2014, the Company has offered electronic voting facility (remote e-voting) for transacting the business through National Securities Depository Limited [NSDL] to enable the members to cast their vote electronically. Additionally, the facility for voting through electronic means shall also be made available at the time of the meeting and Members attending the meeting who have not already cast their vote by remote e-voting shall exercise their right to vote at the meeting. Detailed procedures for remote e-voting and e-

voting at the meeting are provided in the Notice. Members whose names appear on the Register of Members /Register of Beneficial Owners maintained by the Depositories as on the Cut Off Date for voting, i.e **05th September 2024**, shall be entitled to avail the facility of remote e-voting /e-voting at the AGM. Any person, who acquires shares of the Company and becomes a member after dispatch of the Notice but before the cut-off date for voting i.e. 05th September 2024 may obtain the login Id and password by sending a request to evoting nsdl.com or contacting our Registrar & Share Transfer Agents viz. Cameo Corporate Services Limited, "Subramanian Building", No.1 Club House Road, Chennal 600 002. Phone: +91 044 28460390 (5 lines); Fax: +91 044 28460129; Email: investor@cameoindia.com.

The remote e-voting commences on Monday, the 09th September 2024 (9.00 A.M) and ends on Wednesday, the 11th September 2024 (5.00 P.M).

Members will not be able to cast their vote electronically beyond the said date and time (i.e after 5.00 P.M on Wednesday, 11th September 2024) and the remote e-voting module shall be disabled for voting by NSDL thereafter. M/s. G. Ramachandran & Associates, Practising Company Secretaries Chennai has been appointed as Scrutinizer for the remote

voting process /voting at the AGM. The Members who have cast their vote by remote e-voting may attend the meeting but shall not be entitled to cast their vote again

Members whose email addresses are not registered are requested to register their e-mail addresses with the respective depository participants and members holding shares in physical mode are requested to register their e-mail addresses with the Company's Registrar and Share Transfer Agent viz. Cameo Corporate Services Limited by email to Investor@cameoIndla.com

Any Query /Grievance in relation to voting by electronic means can be addressed to Ms. Pallavi Mhatre, Manager, NSDL, 4th Floor, 'A' Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai 400 013 or send an email to : evoting@nsdl.co.in/pallavid@nsdl.co.in/p

(By Order of the Board)

Place : Chennai Date : 12.08.2024

S N Balaji Deputy General Manager (Legal) & Secretary



Regional Office, Rajkot: 1st Floor, Bank of Baroda Building, M.G. Road, Raikot - 360 001

SHIFTING OF MAVDI PLOT BRANCH PREMISES KIND ATTENTION TO OUR MOST VALUED CUSTOMERS

By Virtue of this Notice, all Customers of Bank of Baroda Maydi Plot Branch Rajkot are hereby informed that the branch will be Relocated to its new Premises situated at Ground Floor, Sky Mall, Gondal Road, Near Mercedes Benz Show Room, Near S. T. Workshop, Rajkot. on 14.08.2024.

Customers are therefore requested to please visit the new place of business for their banking need w.e.f. 14.08.2024.

We sincerely regret the inconvenience caused to you in this regard and assure you of our best services at all times. . Date : 13.08.2024 Regional Head, Bank of Baroda

K.Z. LEASING AND FINANCE LIMITED

CIN: L65910GJ1986PLC00864 Regd. Office: Deshna Chambers, B/h. Kadwa Patidar Wadi, Usmanpura, Ashram Road, Ahmedabad - 380014. Phone: 079-27543200

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE FIRST QUARTER AND THREE MONTHS ENDED ON 30TH JUNE, 2024. (Rs.in Lacs)

	•		,
Sr No		Quarter ended on 30/06/2024 (Unaudited)	Quarter ended on 30/06/2023 (Unaudited)
1	Total Income from Operations	336.68	279.52
3	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax	289.39	233.18
ľ	(after Exceptional and / or Extraordinary items)	289.39	223.21
4	Net Profit / (loss) for the period after tax	213.66	165.18
5	Total Comprehensive Income for the period (Comprising Profit /(loss) for the period (after tax)		
l	and other comprehensive Income (after tax)	269.10	229.32
6	Paid-up Equity Share Capital	304.12	304.12
7	Reserves (excluding Revaluation Reserve) as shown		
l	in the Audited Balance Sheet of the previous year		
8	Earnings per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) - Basic and Diluted	7.03	E 42
	- Dasic and Diluted	7.03	5.43

Notes: (1) The above Un-Audited Financial statement for quarter ended June 30, 2024 has been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 12th August, 2024 and Statutory Auditors of the Company have carried out limited review audit of the same. (2) This statement has been prepared in accordance with the Companies (2) This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules 2015 (IND AS) prescribed under section 133 of the Companies Act 2013 and other recognized accounting practices and policies to the extent applicable. (3) IND AS 108 relating to segment wise reporting is Not Applicable as the Company operates in one primary segment i.e "Finance Segment". (4) Figures of previous year / quarter were regrouped / rearranged wherever necessary.

For, K.Z. Leasing and Finance Ltd. Date: 12/08/2024 sd/- Pravinkumar K. Patel (DIN - 00841628)

SAYAJI INDUSTRIES LIMITED Regd. Office: Maize Products, P.O Kathwada,

Ahmedabad-382430 • Tel : +91 79 22901581 to 85 E-Mail: maize@sayajigroup.in Website: www.sayajigroup.ln

PUBLIC NOTICE

Notice is hereby given that the 83rd Annual General Meeting ("AGM") of Sayaji Industries Limited will be held on Wednesday, 11th day of September, 2024 at 11.30 a.m. through Video Conferencing (VC) / Other Audio-Visual Means (OAVM), in compliance with the circulars issued by Ministry of Corporate Affairs (MCA) and SEBI and all other relevant circulars issued from time to time.

The Company is pleased to provide the facility of attending the meeting through VC / OAVM to the members of the Company and facility of voting during the meeting through electronic means in compliance of the above stated circulars. The members holding shares as on the cut-off date (i.e. 06.09.2024) including those who have not received the electronic copy of the annual report of the Company due to non-availability of e-mail ID with the Company / RTA can also exercise their vote by following the instructions given in the Notice of AGM.

In accordance with the above circulars, the Company will send in due course the Annual Report of the Company for the financial year 2023-24 including the Notice of Annual General Meeting by way of an e-mail to those members whose e-mail ID are registered with the Company /RTA, so those members who have not registered their e-mail ID are requested to get the same registered.

Member holding shares in Demat mode are requested to contact their respective Depository Participant for registering the email addresses and members holding shares n physical form are requested to promptly notify in writing in form ISR-1 along with the supporting documents for registering / updating the same with Company / RTA.
The notice of the Annual General Meeting of the Company

also be made available on the Company's webs www.sayajigroup.in and the Stock Exchange Website i.e. BSE Limited at www.bseindia.com.

For, Sayaji Industries Limited sd/-Maulik S. Bhavsar

Date: 13-08-2024

Company Secretary and Compliance Officer Place : Ahmedabad (M.No. - A48786)



Ground Floor, 4 to 20, Rajhans Business Hub, lara-390001., Dist: Baroda. India.

APPENDIX -IV [Rule 8(1)] POSSESSION NOTICE (for Immovable proper

The undersigned being the Authorised Officer of Bank of Baroda, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security nterest Act, 2002 and in exercise of powers conferred upon me under section 13 12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 31.05.2024 calling upon the Borrowers / Guarantors Mortgager M/s. PBSR & Companies through its Partners Mr. Pratapbhansingh Chandrabhansingh Rathore, Mr. Ajitsingh Pratapbhansingh Rathore and Mr. Ashish Pratapbhan Singh Rathore to repay the amount mentioned in the notice being Rs. 4,82,43,044.18 (Rupees Four Crore Eighty Two Lakhs Forty Three Thousand Forty Four and Paisa Eighteen Only) as on 30.05.2024 (inclusive interest up to 25.05.2024) plus further interest and expenses within 60 days from the date of notice/date of receipt of the said notice.

The Borrower/Guarantor/Mortgagor having failed to repay the amount, notice i hereby given to the Borrower Guarantor Mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on this 07th day of August the year 2024.

The Borrowers/Guarantors Mortgagors in particular and the public in general hereby cautioned not to deal with the property and any dealings with the property wi e subject to the charge of the Bank of Baroda, for an amount of Rs 4,75,41,416.36 (Rupees Four Crore Seventy Five Lakh Forty One Thousand Four Hundred Sixteen and Paisa Thirty Six Only) as on 06.08.2024 (inclusive interest upto 04.08.2024) plus further interest and other charges thereon.

The borrower's attention is invited to provision of sub section (8) of the section 13 o the Act, in respect of time available, to redeem the secured assets

DESCRIPTION OF IMMOVABLE PROPERTY Industrial Property including Land & Building situated at District - Vadodara Sub-District- Savii, Moje : Pratapnagar, Land bearing Block / R.S. No. 108, 109/P Khata No. 142, 143, 154 & 146 Total land adm. 10416.38 Sq. Mtr. among them. 923.70 Sq. Mtr construction thereon belonging to Mr. Prataphhansing Chandrabhansingh Rathore, Mr. Ashish Pratapbhansingh Rathore and M Ajitsingh Pratapbhansingh Rathore. The Boundaries are:-East: Survey No. 113 West: Way to Savli, North: Survey No. 107/1 & 107/2, South: Survey No. 109/P

2. Hypothecation of Plant & Machineries, Electrical Installations, Furniture and xture, Office Equipment's, Misc. Fixed Assets and other movable fixed assets of the Firm

3. Hypothecation of Stock & Book Debt

Date: 07.08.2024 Place: Pratapnagar, Vadodara **Authorised Officer Bank of Baroda**

HERO HOUSING FINANCE LIMITED

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTIES (As per Appendix IV reed with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002

Whereas, the undersigned being the Authorized Officer of the Hero Housing Finance
Limited, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement
of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read
with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, Issued a demand notices as
mentioned below calling upon the Borrowers to repay the amount mentioned in the notice
within 60 days from the date of the said notice.

The borrower, having failed to repay the amount, notice is hereby given to the borrower, in particular and the public, in general, that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said Rules.

The borrower, in particular, and the public in general, are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Hero Housing Finance Limited, for an amount referred to below along with interest thereon and penal interest,

The borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act in respect of time available, to redeem the secured assets

Loan	Name of Obligor(s)	Date of Demand	Date of Possession
Account	/Legal Heir(s)/	Notice/ Amount as per	(Constructive
No.	Legal Representative(s)	Demand Notice	/Physical)
HHFSURHOU 23000037840, HHFSURIPL 23000037841		15/03/2024, Rs. 11,84,797/- as on date 15/03/2024	10/08/2024 (Physical)

Description of Secured Assets/Immovable Properties:- All that piece and parcels of land bearing Piot No. 198 admeasuring 49.33 Sq. Mts. according to the booking plan (as per KJP it was given Block/Survey No 184/198) an admeasuring about 41.28 Sq. Mts. with construction on it having together with undivided proportionate share in Road and COP admeasuring about 25.28 sq. mts. of "Shree Vallabh Residency" organized on land bearing Revenue Survey no 148/2, 149. Block No 170 (after promulgation it was given New Block No 184) an admeasuring about 3-77-23 sq. mts. of Village: Haldharu, Sub District: Kamena, District: Surat in the state of Gujerat With Common Amenties Written in Title Document. Property Bounded By: East: Adj. Plot No 173, West: Adj. Society internal Road, North: Adj. Plot No 199, South: Adj. Plot No 197

Sd/- Authorised Officer FOR HERO HOUSING FINANCE LIMITED DATE :- 13-08-2024, PLACE:- SURAT



State Bank of India - Silvassa (06586)

Nisharg, Apartment , NR Yogi Hospital, Silvassa. Email : sbi.06586@sbi.co.in

POSSESSION NOTICE (For immovable Property) Whereas, The undersigned being the Authorized Officer of the State Bank of India under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security interest Act, 2002 and in exercise of powers conferred under Section13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 002, issued a demand notice dated 05/06/2024 calling upon the Annpurna 2002, issued a demand notice dated 05/06/2024 calling upon the Annpurna Enterprises Borrower Mr. Dipak Chakrapani Pathak And Mrs.mishra Sarladevi Satyanarayan to repay the amount mentioned in the notice being Rs.18,94,435/- + Interest (Charges) (Rupees Eighteen Lakh Ninety Four Thousand Four Hundred Thirty Five + Interest (Charges)) with interest, cost, charges, etc, within 60 days from the date of receipt of the said notice. The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers/ guarantors and the public in general that the undersigned has taken the Symbolic passession of the properties described herein below in exercise of powers conferred upon me under Section 13(4) of the said Act read with Rule 8 of

owers conferred upon me under Section 13(4) of the said Act read with Rule 8 of ne said rules on this 06/08/2024.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with theproperties will be subject to the charge of the State Bank Of India, Silvassa, Nisharg, Appartment, NR Yogi Hospital for an amount of Rs.18,94,435/- + Interest (Charges) (Rupees Eighteen Lakh Ninety Four Thousand Four Hundred Thirty Five + Interest (Charges)) entioned in the notice and further interest thereon. The borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Property

Flat No 202, Second Floor, Building No B2, KP Vihar, Survey No. 400/1, Near Ram Mandir , Dadra, Opp. Essar Petrol Pump, Dadra Nagar Haveli 396230.

Date: 06/08/2024

Authorized Officer & Chief Manager, State Bank of India.

PUBLIC NOTICE

It is hereby informed that Government of India in State Level Environmental Impact Assessment Authority, Gujarat; has accorded the Environment Clearance to Mr. Mukesh Narbheram Chadderwala for New Construction Project named. Shyam Richmond" set up at New Survey No. 2200, Old Survey No. 148/A Vill. Umraj, Ta. Bharuch, Dist. Bharuch; under the Provisions of EIA Notification dated 14th September 2006

The copy of Environment Clearance letter No. SEAC/GJ/INFRA2 /469696/20005/2024 is available with us, Sate Level Environment Impact Assessment Authority and may also be seen at the website of MOEFCC on PARIVESH.nic.in

Date: 12.08.2024 Place: Bharuch

Mukesh Narbheram Chadderwala

50 years of purpose over influence.



50 Years of Insight

કેરળ અને મદ્રાસ હાઈકોર્ટના ચુકાદા પછી હવે સુપ્રિમના ફેંસલા પર મીટ

ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી એ ગણાય? સૃપ્રિમનો ચૂકાદો અનામત

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે (૧૨ ઓગસ્ટ) ચાઇલ્ડ પોર્નોગ્રાફી | સંબંધિત કેસની સુનાવણી કરી. કેરળ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ફોન પર બાળકો સાથે સંબંધિત પોર્ન વીડિયો ડાઉનલોડ કરવો ગુનો નહીં ગણાય.

કેરળ હાઈકોર્ટે ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ એક ેકેસની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ ખાનગી રીતે અશ્લીલ ફોટા અથવા વીડિયો જોતો હોય તો તે ગુનો નથી, પરંતુ જો તે અન્ય લોકોને બતાવતો હોય તો તે 🧱 ગેરકાયદેસર ગણાશે.

પછી મદ્રાસ હાઈકોર્ટમાં તેના આધારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય હાલ પૂરતો અનામત રાખ્યો છે.

કેરળ હાઈકોર્ટે કહ્યું- પોર્ન જોવું એ વ્યક્તિની અંગત પસંદગી છે, તેમાં

આ નિર્ણય કેરળ હાઈકોર્ટના જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણનની બેન્ચે આપ્યો છે. જસ્ટિસ કુન્હીકૃષ્ણને કહ્યું હતું કે, સદીઓથી પોર્નોગ્રાફી પ્રચલિત છે.

આજે ડિજિટલ યુગમાં તે સરળતાથી ઉપલબ્ધ છે. તે બાળકો અને વયસ્કોની આંગળીના વેઢે ઉપલબ્ધ છે.સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિ પોતાના પ્રાઈવેટ ટાઈમમાં પોર્ન બીજાને બતાવ્યા વગર જોતા હોય તો તે ગુનો છે કે નહીં? જ્યાં

> શકાય નહીં કારણ કે તે વ્યક્તિની વ્યક્તિગત પસંદગી હોઈ શકે છે. આમાં દખલગીરી તેની ગોપનીયતામાં ઘૂસણખોરી

કેરળ હાઈકોર્ટની આ ટિપ્પણીને આધાર તરીકે ટાંકીને. મદ્રાસ હાઈકોર્ટે ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ વાસ્તવમાં, એક એનજીઓએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો કર્યો કર્યો કર્યો કર્યો કર્યો હતો જ્યારે એક આરોપીને પહેલા કેરળ હાઈકોર્ટમાં અને કર્યો હતો જ્યારે એક આરોપીને પહેલા કેરળ હાઈકોર્ટમાં અને કર્યો હતો કરાય હાઈકોર્ટ કહ્યું હતું કે કોઈના ઉપકરણ પર ચાઈલ્ડ

> કોર્ટે આ ટિપ્પણી ૨૮ વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન કરી હતી. બાળ પોર્નોગ્રાફીના આરોપમાં તે વ્યક્તિ વિરુદ્ધ POCSO (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સ) એક્ટ અને IT એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી સામે ચાલી રહેલા

હિંડનખર્ગનો રિપોર્ટ ભારત-

અમેરિકી રિસર્ચ એજન્સી હિંડનબર્ગે સેબીના ચેરપર્સન સામે તોપ તાકી છે આક્ષેપો સાથે તપાસની માંગ કરતા સોમવારે ઉઘડતાવેંત માર્કેટ ધસી પડે. નિવેદન સામે ભાજપે સમગ્ર બનાવને

કહ્યું કે હિંડનબર્ગનો રિપોર્ટ ભારત સેબીએ પછી હિંડનબર્ગ વિરુદ્ધ ગત સામેનુ મોટ્ર ષડયંત્ર છે. લોકસભાની મહિને નોટીસ ઈસ્યુ કરી હતી તેનો ચુંટણીમાં સળંગ ત્રીજી હારથી કોંગ્રેસ, બદલો લેવા માટે અમેરિકન કંપનીએ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ તથા નવો પાયાવિહોણો રિપોર્ટ જાહેર કર્યો તેમને પ્રમોટ કરતા લોકો ભારતને છે. આર્થિક રીતે અસ્થિર બનાવવા મેદાને

કોંગ્રેસના સવાલો બાદ ભાજપના વળતા પ્રહાર

ષડયંત્ર ગણાવીને ભારતીય માર્કેટને વિરુદ્ધ રિપોર્ટ જાહેર કર્યો હતો. સર્વોચ્ચ અસ્થિર કરવાનુ ષડયંત્ર ગણાવ્યું છે. અદાલતે પોતાના કાર્યક્ષેત્રમાં જ તપાસ ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કરાવી હતી તેમાં કાંઈ નિકળ્યુ ન હતું.

ભારતના ટોચના ઉદ્યોગજૂથ સમય વિશે સવાલ ઉઠાવતા કહ્યું હતું અત્યારસુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થઈ શકે છે. ભારતમાં નાના અદાણીને નિશાન બનાવ્યા બોદ કે અમેરિકન કંપનીએ ઈરાદાપૂર્વક નફરત કરતી હતી પરંતુ હવે દેશને ઈન્વેસ્ટરોની સંખ્યા કરોડોમાં છે.

હિંડનબર્ગે દોઢ વર્ષ પુર્વે અદાણી

ભાજપના નેતાએ એવો ગંભીર

કેજરીવાલની જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી

કાંડમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ છે. હાઇકોર્ટે કહયું હતું કે અને આમ આદમી પાટીના નેતા કેજરીવાલની ધરપકડ ના તો મનીષ સિસોદીયાને જામીન સુપ્રિમ ગેરકાયદે છે કે ના તો કારણ વગરની કોર્ટમાંથી મળ્યા બાદ હવે દિલ્હીના છે. હવે જામીન માટે કેજરીવાલે સીએમ અરવિંદ કેજરીવાલે પણ સુપ્રિમમાં ધા નાખી છે. જામીન માટે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

ઉક્ષેખનીય છે કે ઇડીના મની લોન્ડ્રીંગ કેસમાં અગાઉ વચગાળાના જામીન આપી ચૂકી છે. હવે કેજરીવાલે સીબીઓઇના કેસમાં જામીન અરજ સુપ્રિમ કોર્ટમાં કરી

કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટે કથિત સિકર એકસાઇઝ તા.પ ઓગસ્ટના ફેસલાને પડકાર્યો

નામ બદલેલ છે

મારું નામ પટેલ સંદીપકુમાર બાબુલાલ બદલીને પટેલ સંદીપભાઈ બાબુભાઈ રાખેલ છે. સરનામું: બી-૮૯, આસોપાલવ સોસાયટી, મહાલક્ષ્મી તળાવ પાસે, વટવા, અમદાવાદ.

સફલ હાર્ટ હોસ્પિટલ ફર્મનં : GUJGND01567

(પાર્ટનરશિપ એક્ટ, ૧૯૩૨ હેઠળ રજિસ્ટર્ડ) રજિસ્ટર્ડ ઓફિસ: Sh. નં.૨૦૧થી ૨૦૪ અને ૨૨૪થી ૨૩૪, SF શિવમ ઓરબિટ, NH૮, એસએસ મહેતા કોલેજ નજીક, હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત-૩૮૩૦૦૧

नोटिस ફोर्म नं. यु.आ२.सी.-२ પ્રકરશ-૨૧ અંતર્ગત વિભાગ-૧ હેઠળ નોંધણી અંગે નોટિસ આપતી જાહેરાત

(ઓથોરાઈઝડ ટુ રજીસ્ટર) નિયમો, ૨૦૧૪નો નિયમ ૪(૧)ની બાબતમાં:) ૧. આથી નોટિસ આપવામાં આવે છે કે, કંપનીઝ એક્ટ ૨૦૧ રની કલમ ૩૬૬ની પેટા કલમ (૨) અન્વયે લિમીટેડ લાયબિલિટી પાર્ટનરશિપ કર્મ M/S. સફલ હાર્ટ હોસ્પિટલ (કર્મ નં. GUJGND01567), કંપનીઝ એક્ટ, ૨૦૧૩ના પ્રકરશ-૨૧ના વિભાગ-૧ હેઠળ મર્યાદિત સંખ્યામાં શેરો ધરાવતી કંપની તરીકે નોંધણી કરાવવા માટે સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સેન્ટર સમક્ષ (CRC) પંદર દિવસ બાદ, પણ રજિસ્ટ્રારની ત્રીસ દિવસની મુદ્દત પૂર્ણ થાય તે પહેલાં અરજી કરવાની દરખાસ્ત કરેલ છે.

(કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની કલમ ૩૭૪(બી) અને કંપનીઝ

ર. કંપનીનો મુખ્ય હેતુ નીચે પ્રમાણે છે :

- a) બિઝનેસનો મુખ્ય હેતુ મેડિકલ સર્વિસિઝ હેન્ડલિંગ હોસ્પટિલ અને મેડિકલ સ્ટોરનું સંચાલન તથા તે સંબંધિત સેવાઓ અને કામગીરીનો છે.
- b) ભારત અને વિદેશમાં હોસ્પિટલ્સ, ક્લિનિક્સ, નર્સિંગ હોમ્સ, ફાર્મસી, હિસ્પેન્સરી, મેટરનિટી હોમ્સ, વૃદ્ધાશ્રમ, હેલ્થ રિસોર્ટ્સ અને હેલ્થ ક્લબ, તમામ પ્રકારની એમ્બ્યુલેટરી સર્વિસિઝ, પોલિક્લિનિક્લસ, મેડિકલ સેન્ટર્સ, બાળ અને મહિલા કલ્યાણ અને પરિવાર આયોજન કેન્દ્રો, ડાયગ્રોસ્ટિક સેન્ટર્સ, આરોગ્ય સેવાઓ અને રિસર્ચ સેન્ટર્સ-લેબોરેટરી, અને તમામ પ્રકારની મેડિકલ અને આરોગ્ય સંભાળ કામગીરીઓ માટે ખરીદી, વેચાણ, સંચાલન, સુધારાઓ, જાળવણી, ભાડેપટ્ટે ખરીદી, પ્રોત્સાહન, એડમિનિસ્ટર, વ્યવ્સ્થાપન અને અન્ય કરારો તથા લાયન્સ મેળવવા સહિતની કામગીરી કરે છે.

c) સફલહાર્ટ હોસ્પિટલ હસ્તગત કરવા (પાર્ટનરશિપ)

- 3. સૂચિત કંપનીના ડ્રાફ્ટ મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની નકલ ઓફિસ Sh. નં. ૨૦૧થી ૨૦૪ અને ૨૨૪થી ૨૩૪, SF શિવમ ઓરબિટ, NH૮, એસએસ મહેતા કોલેજ નજીક, હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત-૩૮૩૦૦૧ પર તપાસ થઈ શકે છે.
- ૪. આથી નોટિસ આપવામાં આવે છે કે, આ અરજી સામે વાંધો ધરાવતી કોઈપણ વ્યક્તિએ તેમનો વાંધો લેખિતમાં નોટિસ પ્રકાશિત થયાના ૨૧ દિવસ સુધીમાં રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ, સેન્ટલ રજીસ્ટ્રેશન સેન્ટર, ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ (IICA), પ્લોટ નં. ૬,૭,૮ સેક્ટર-પ, IMT માનેસર, ગુરગાંવ, હરિયાણા-૧૨૨૦૫૦ના સરનામે મોકલવાનો રહેશે. તેની એક નકલ કંપનીને તેની રજિસ્ટર્ડ ઓફિસે મોકલવાની રહેશે.

ારીખ: ૦ ઑગસ્ટ, ૨૦૨૪ થળઃ હિંમતનગર	સફલ હાર્ટ હોસ્પિટલ વર્તી, સહી/- કલ્પેશ કુમાર હસમુખલાલ પટેલ પાર્ટનર	સફ્લ હાર્ટ હોસ્પિટલ વર્તી, સહી/- હસમુખલાલ મણીલાલ પટેલ પાર્ટનર	સફલ હાર્ટ હોસ્પિટલ વર્તી, સહી/- નચનાઇન હસમુખલાલ પટેલ પાર્ટનર
--	---	--	---

સુધી કોર્ટનો સંબંધ છે, તેને અપરાધ તરીકે વર્ગીકૃત કરી

પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી એ ગુનાના દાયરામાં નથી આવતું.

નવી દિલ્હી તા.૧૨ પડયા છે.તેઓએ હિંડનબેંગે રિપોર્ટનાં આક્ષેપ લગાવ્યો હતો કે કોંગ્રેસ ઈન્વેસ્ટરોને જ સૌથી મોટી પરેશાની

રવિશંકરે એવો સવાલ ઉઠાવ્યો હતો કે ભૂતકાળમાં ભારત દાણા–દાણા ત્યારે સમગ્ર ઘટનાક્રમમાં રાજકીય શનિવારે રિપોર્ટ જારી કર્યો હતો. જેને નફરત કરવા લાગી છે. ભારતીય માટે મોહતાજ હતું તે યુગમાં કોંગ્રેસ ધમાસાણ શરૂ થઈ ગયુ છે. કોંગ્રેસના પગલે રવિવારે ગભરાટ ઉભો થાય અને શેરબજાર ડગમગે તો નાના દેશને ફરી લઈ જવા માંગે છે.

> IN THE COURT OF HONORABLE JUDGE SHRI D.A. VORA SIR COURT NO. 05 PUBLIC SUMMONS

IN THE COURT OF COMMERCIAL COURT AT CITY CIVIL COURT OF AHMEDABAD COMMERCIAL CIVIL SUIT NO. 465/2022

Plaintiff: Punjab National Bank Having its head office at Plot No. 4, Sector-10, Dwarka, New Delhi-110075 and inter alia branch office at Circle Sastra, 6th Floor, Gujarat Bhavan, Ellisbridge Ashram Road, Ahmedabad, Gujarat - 380006. **VERSUS**

102, Welcome Residency, Meghraj Road, Taluka Modasa - 383315. Also at: 125, GIDC,

Ganeshour, Dist. Aravalli, Modasa - 383315 Defendant: 2. Sh. Dipak Kumar Patel: A-304, Utsav Heights, Meghraj Road, Modasa Suit Valued at Rs. 11.70.801.35

Defendant: 1. Smt. Ankitaben Rajeshkumar Pokar - Prop. of M/s. Ramdev Disposable

Whereas you the defendant is/are hereby informed that the summons issued against you by this court through bailiff and/or Register Post Ad. has returned unserved subsequently, and as your current whereabouts are unknown, hence in the consequence court ordered this

Whereas Plaintiff above named has instituted a suit relating to a commercial dispute against you and you are hereby summoned to file a written statement within 30 days of the service of the present summons and in case you fail to file the written statement within 30 days, you shall be allowed to file the written statement on such other days, as may be specified by the court, for reasons to be recorded in writing and on payment of such costs as the court deems fit, but which shall not be later than 120 days from the date of services of summons. On expiry of one hundred and twenty days from the date of services of summons you shall forfeit the right to file the written statement and the court shall not allow the written

You are required to appear in this Court in person, or by a pleader duly instructed, and able to answer all material questions relating to suit, or who shall be accompanied by some person able to answer all such question, on the 17 day of August of 2024 at 11:00 O'Clock in the fore noon, to answer the claim lodged by the applicant seeking interim injunction as prayed and further you are hereby to produce on the said day all documents in your possession or power upon which you base your defense or claim for set-off or counterclaim, and where you rely on any other document whether in your possession or power or not, as evidence in support or you defense or claim for set-off, or counter-claim you shall enter such documents in list to be annexed to the written statement.

Take notice that, in default of your appearance on the day before mentioned the suit will be heard and determined in your absence. Witness Shri Ahmedabad Aforesaid, Plaintiff's Advocate - M.B. Suthar

Given under my hand and the seal of the Court on 8th day of August 2024.

(C.M. Mahida) Prepared by Assistant

(V.M. Rana) Compared By Superintenden



(H.S. Desai) Registrar, City Civil Court, Bhadra, Ahmedabad

એરો લેમ લિમીટેડ AIROL&M CIN: L20211GJ2007PLC052019

રજી. ઓફિસ : સર્વે નં. ૩૫૫, નાનનપુર રોડ, ને.હા. નં. ૮, ગામ - દલપુર, તાલુકો - પ્રાંતિજ, હિંમતનગર, ગુજરાત-૩૮૭૧૨૦.

Ph: +91 2770-240572/73, E-mail: cs1@airolam.com, Website: www.airolam.com

૧૯મી વાર્ષિક સામાન્ય સભા, ઈ-વોર્ટીંગ માહિતી અને ભુક કલોઝરની નોટીસ એરો લેમ લિમીટેક (કંપની) ના સભ્યોની ૧૭મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ), મંગળવાર

૦૩મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે, સર્વે નં. ૩૫૫, નાનનપુર રોડ, ને.હા. નં. ૮, ગામ - દલપુર, તાલુકો - પ્રાંતિજ, હિંમતનગર, ગુજરાત - ૩૮૩૧૨૦ ખાતે તારીખ પમી ઓગસ્ટ, ૨૦૨૪ ની એજીએમની નોટીસ આપ્યા મુજબ કામકાજ કરવા માટે યોજાશે.

નાણાકીય વર્ષ ૨૦૨૩ - ૨૪ માટે એજીએમ અને વાર્ષિક અહેવાલની નોટીસ કંપની / ડિપોઝીટોરી સહભાગીઓ સાથે ઈમેલ સરનામું નોંધણી કરાવ્યું હોય તેવા સર્વ સભ્યોને ઈલેક્ટ્રોનિક માધ્યમથી મોકલવામાં આવી છે કંપનીએ ૨ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ નોટીસ અને વાર્ષિક અહેવાલ મોકલી આપવાનું કામ પૂર્શ કર્યું છે. સભ્યો નિમ્નલિખિત લિંક : www.airolam.com પર થી પણ વાર્ષિક અહેવાલ અને એજીએમ ની નોટીસ ડાઉનલોડ કરી શકે છે.

લીંક ઈન-ટાઈમ ઈન્ડિયા પ્રા. લિ. ("LIIPL") ની ઈલેક્ટ્રોનિક વોટીંગ દ્રારા એજીએમની નોટીસમાં જણાવ્યા મુજબ કટઓફ તારીખ એટલે કે ૨૭ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ પ્રત્યક્ષ અથવા ડિમટીરિયલાઈઝ્ડ સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યો એજીએમની નોટીસમાં જણાવ્યા મુજબ બિઝનેશ પર તેમનો મત ઈલેકટ્રોનિક રીતે (રીમોટ ઈ-વોટીંગ) એજીએમ સ્થળ સિવાય આપી શકે છે. તમામ

સભ્યોને જાણ કરવામાં આવે છે કે. : એજીએમની નોટીસમાં જણાવ્યા મુજબનો વ્યવસાય ઈલેટ્રોનિક માધ્યમથી મતદાન દ્રારા વ્યવહાર કરી

રિમોટ ઈ-વોટિંગ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ સવારે ૯:૦૦ વાગ્યે આરંભ થશે. રિમોટ ઈ-વોટિંગ ૦૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ સાંજે ૫:૦૦ વાગ્યે સમાપ્ત થશે.

ઈ-વોટિંગ મારફત વોટ આપવા માટે અને એજીએમમાં વોટ આપવા માટે સભ્યોની પાત્રતા નિશ્વિત કરવા માટે કટ ઓફ તારીખ ૨૭ઓગસ્ટ, ૨૦૨૪ છે.

રિમોટ ઈ-વોટિંગ મોડ દ્રારા ઈ-વોટિંગ ૦૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ સાંજે પ:૦૦ વાગ્યા પછી ડિઝેબલ કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેર એજીએમની નોટીસ મોકલ્યા પછી પ્રાપ્ત કરે છે અને કંપનીના સલ્ય

બને છે અને ૨૭ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ કટ ઓફ તારીખ મુજબ શેર ધરાવે છે તે એજીએમની નોટીસમાં દર્શાવેલ વિગત પ્રમાણે લોગિન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. સભ્યો લીંક ઈન-ટાઈમ ના નંબર : ૦૨ ૨-૪૯૧૮ ૬૦૦૦ પર ફોન કરી શકે છે અથવા enotices@linkintime.co.in પર ઈમેલ વિનંતી મોકલી શકે છે.

ઈ-વોટિંગ પર કોઈ પ્રશ્નો હોય તો, સભ્યો ઈ-વોટિંગ પર મદદ અને FAQ નો સંદર્ભ લઈ શકે છે અને https://instavote.linkintime.co.in ના ઉપલબ્ધ શેરધારકો માટે વપરાશકર્તા માર્ગદર્શિકા અથવા લીંક ઈન-ટાઈમ ના નંબર : ૦૨૨ - ૪૯૧૮૬૦૦૦ પર ફોન કરી શકે છે અથવા enotices@linkintime.co.in પર ઈમેલ વિનંતી મોકલી શકે છે.

કંપની એજીએમમાં પ્રત્યક્ષ બેલેટ પેપર દ્રારા મતદાન કરવાની સુવિધા પણ પૂરી પાડશે અને એજીએમમાં ભાગલેનારા સભ્યો કે જેમણે પહેલાથી જરિમોટ ઈ-વોર્ટિંગ દ્રારા તેમના મત આપ્યા નથી તેઓ એજીએમમાં તેમના મતના અધિકારનો ઉપયોગ કરી શકશે. સભ્યો, જેમણે રિમોટ ઈ-વોટિંગ દ્રારા પોતાનો મત આપ્યો છે તેઓ પણ એજીએમમાં હાજરી આપી શકે છે પરંતુ ફરીથી મત આપવા માટે હકદાર રહેશે નહીં.

એજીએમની નોટીસ કંપનીની વેબસાઈટ www.airolam.com પર ઉપલબ્ધ છે. કંપનીના સભ્યોનું રજીસ્ટર અને શેર ટ્રાન્સફર બૂક્સ વાર્ષિક સામાન્ય સભા માટે બુધવાર, ૨૮ ઓગસ્ટ, ૨૦૨૪ થી મંગળવાર, ૦૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી બંધ રહેશે.

એરો લેમ લિમીટેક વતી. वल : अंतिक

ચિંતનલુમાર કે. મેહુરિય

દી આદર્શ કો-ઓ. ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સ લી. ૨૧, સુરમ્ય એપાર્ટમેન્ટ, નિગમ બસ સ્ટેન્ડ પાસે, જેગસપાર્ક રોડ, દોડાસર,અમદાવાદ-૫૦. ફોન : ૨૫૪૬૦૦૨૨

વાર્ષિક સાધારણ સભા અંગેની નોટીસ

ધી આદર્શ કો-ઓ. ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સ લી. ના તમામ સભાસદશ્રીઓને જણાવવામાં આવે છે કે સંસ્થાની ૪૦મી વાર્ષિક સાધારણ સભા તા.૨૮-૦૮-૨૦૨૪ ને બુધવાર ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે શ્રી પુનિત સેવા આશ્રમ, પુનીત માર્ગ, શ્રી રામજી મંદિર સામે, મણિનગર, અમદાવાદ-૩૮૦૦૦૮ માં મળશે તો દરેક સભાસદ ભાઇ-બહેનોને સમયસર હાજર રહેવા વિનંતી છે. વર્ષ ૨૦૨૩–૨૪ નો વાર્ષિક અહેવાલ સંસ્થાની ઓફિસેથી કામકાજના સમય દરમ્યાન મેળવી શક્શો.

શ્રી કૉ.હસમુખભાઈ કે. ખોખાણી - (ચેરમેનશ્રી) **આમદાવાદ** બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીના હુકમથી dl. 92-04-2058

District Judge-1, Khamgaon, Dist. Buldana, (M.S.) IN THE COURT OF Shri P.P. Kulkarni

Notice of disclosure F.F.28-08-2024 Janardan Pundlik Dhurandhar Rujifarhin

To, Rujifarhin Aniulhaq Ansari Address: 23/B, A1 Aman Society, V-B, Opp. Alhamd Park, Ahmedabad (Gujrat) 380028 Whereas has institued a Motor Accident Claim Petition impleading you as one of the respondents, which case has been directed to be listed before this Tribunal/Court for hearing at 10.00am on 28-08-2024

before this Tribunal/Court for hearing at 10.00am on 28-08-2024

Now therefore you are given notice to appear in this Tribunal/Court in person or by a pleader duly instructed (and able to answer allmaterial questions relating to the suit, or who shallbe accompanied by some person, able to answer all such questions), on the 28-08-2024 at 11:00c clock in the forenoon, to answer the claim: and and further you are hereby directed to file on that day a written statement of your defence and to produce on the said day all documents in your possession or power upon which you base your defence, and where you rely on any other document whether in your possession or power or not, as evidence in support of your defence, you shall enter such documents in a list to be annexed to the written statement Take notice that, in default of your appearance on the day before mentioned, the suit will be heard and determined in yout absence.

By Order

Date: 16-07-2024

District Judge-I and Addl. Session Judge, Khamgaon, District Buldana.

K.Z. LEASING AND FINANCE LIMITED CIN: L65910GJ1986PLC00864

Regd. Office: Deshna Chambers, B/h. Kadwa Patidar Wadi, Usmanpura Ashram Road, Ahmedabad - 380014. Phone: 079-27543200 EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE FIRST QUARTER AND THREE MONTHS ENDED ON 30TH JUNE, 2024. (Rs.in Lacs)

Sr	Particulars o.	Quarter ended on 30/06/2024 (Unaudited)	Quarter ended on 30/06/2023 (Unaudited)
1	Total Income from Operations	336.68	279.52
3	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax	289.39	233.18
	(after Exceptional and / or Extraordinary items)	289.39	223.21
4	Net Profit / (loss) for the period after tax	213.66	165.18
5	Total Comprehensive Income for the period (Comprising Profit /(loss) for the period (after tax) and other comprehensive Income (after tax)	269.10	229.32
6	Paid-up Equity Share Capital	304.12	304.12
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year		
d	Earnings per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) - Basic and Diluted	7.03	5.43

June 30, 2024 has been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 12th August, 2024 and Statutory Auditors of the Company have carried out limited review audit of the same (2) This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules 2015 (IND AS) prescribed under section 133 of the Companies Act 2013 and other recognized accounting practices and policies to the extent applicable. (3) IND AS 108 relating to segment wise reporting is Not Applicable as the Company operates in one primary segment i.e "Finance Segment". (4) Figures of previous year quarter were regrouped / rearranged wherever necessary. Date : 12/08/2024 Place : Ahmedabad For, K.Z. Leasing and Finance Ltd. sd/- Pravinkumar K. Patel (DIN - 00841628

સચાજી ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ

ILAYAS

CIN: L99999GJ1941PLC000471 રજી. ઓફીસ : મેઇઝ પ્રોડક્ટ્સ, પો.ઓ. કઠવાડા, અમદાવાદ-382430 ફોન : +91 79 22901581 - 85

E-Mail: maize@sayajigroup.in - Website: www.sayajigroup.ln

જાહેર સૂચના

આથી સૂચના આપવામાં આવે છે કે કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (MCA) અને SEBI દ્વારા જારી કરાયેલા પરિપત્રો અને સમયાંતરે જારી કરાયેલા અન્ય તમામ સંબંધિત પરિપત્રોના પાલનમાં સયાજી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ૮૩મી વાર્ષિક સામાન્ય સભા (AGM) બુધવાર ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૧૧-૩૦ વાગ્યે વિડીયો કોન્ફરન્સીંગ (VC) / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો (OVAM) દ્વારા ઉપર જણાવેલા પરિપત્રોના પાલનમાં કંપનીના દ્વારા તેના સભાસદોને VC/

OVAM દ્વારા મીટીંગમાં હાજરી આપવાની સુવિધા અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી મિટીંગ દરમ્યાન મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. કટ-ઓફ તારીખ (એટલે કે ૦૬-૦૯-૨૦૨૪)ના રોજ શેરધરાવનાર સભ્યો સહિત જેમણે કંપનીની RTA પાસે ઇ-મેઇલ આઇડી ઉપલબ્ધ ન હોવાને કારણે કંપનીના વાર્ષિક અહેવાલની ઇલેક્ટ્રોનિક નકલ પ્રાપ્ત કરી નથી તેઓ પણ એજીએમની સૂચનામાં આપેલી સૂચનાઓને અનુસરીને તેમના મતનો ઉપયોગ કરી શકે છે.

ઉપરોક્ત પરિપત્રો અનુસાર, કંપની નાણાંકિય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે કંપનીનો વાર્ષિક અહેવાલ જેમાં વાર્ષિક સમાન્ય સભાની સૂચના પણ શામેલ છે, તે કંપનીના સભાસદોને જેમના ઇ-મેલ આઇડી કંપની / RTA સાથે નોંધાયેલ છે, તેઓને ઇ-મેલ દ્વારા મોકલવામાં આવશે. જે સભ્યોએ તેમનું ઇ-મેઇલ આઇડી રજીસ્ટર કરાવ્યું નથી તેઓને તે રજીસ્ટ્રેશન કરાવવા વિંનતી છે.

ડીમેટ મોડમાં શેરધરાવતા સભ્યોને ઇ-મેલ સરનામાની નોંધણી માટે તેમના સંબંધિત ડિપોઝીટરી સહભાગીનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે અને ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યોને તેની નોંધણી / અપડેટ કરવા માટે સહાયક દસ્તાવેજો સાથે કોર્મ ISR-1 માં લેખિતમાં કંપની / આરટીએ નો તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

કંપનીની વાર્ષિક સામાન્ય સભાની સૂચના કંપનીની વેબસાઇટ www.sayajigroup.in અને BSE લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર પણ ઉપલબ્ધ કરાવામાં આવશે.

તારીખ : ૧૩-૦૮-૨૦૨૪ સ્થળ : અમદાવાદ

સહી/-મોલિક એસ. ભાવસાર કંપની સેકેટરી અને કમ્પ્લાયન્સ ઓફીસર (M.No. - A48786)

सथाञ्ज छन्डस्ट्रीञ वि. वती.

જાહેર નોટીસ

આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર ના સબ-ડીસ્ટ્રીકટ અને તાલુકા ગાંધીનગર ની ૩૯૪૨૪.૭૫ ચો.મી. બિન ખેતીની જમીન (જૂના એકગિત બ્લોક નંબર-૪૯૪,૪૮૦,૪૮૧,૪૮૨,૪૮૩,૫૦૨,૫૦૪,૫૦૫ પૈકી). "સમર્પણ" નામની સ્ક્રીમ કેજે અંબા ટાઉનશીપ નો એક ભાગ છે. જેમાં આવેલ સમર્પણ - ર બિલ્ડીંગ ના બીજા માળે આવેલ ફ્લેટ નંબર- ૧૧૩, (ગુડાએ મંજુર કરેલા પ્લાન મુજબ બ્લોક નંબર ૪૪૪/૨૬૮ ઉપર બાંધવામાં આવેલ સમર્પણ-૨ બિલ્કીંગના ફલેટ નંબર-૧૧°૩) ની ૩૦.૯૪ ચો.મી. બાંધકામવાળી મિલકત તથા સ્કીમની જમીનમાં વણ વહેચાયેલ ૧૭.૭૬ ચો.મી. ના હક્ક તથા સ્ક્રીમની જમીનમાં આવેલ આંતરિક રોડ-રસ્તા તથા સાર્વજનિક પ્લોટની જમીનમાં વણ વહેચાયેલ વરાડે પડતા હક્ક, હિસ્સા તેમજ વપરાશી હક્કો સહીતની સ્થાવર મિલ્કત, કે તે સ્થાવર મિલ્કત ૧) દક્ષ જ યંતીલાલ ચોટલીયા ૨) જયંતીલાલ બાબુલાલ ચોટલીયા એ તા. ૨૮/૦૨/૨૦૧૨ ના રોજ સબ-૨જીસ્ટ્રાસ્થ્રી, ગાંધીનગર . ની કચેરીમાં અનુક્રમ નંબર ૨૫૪૯ થી નોંધાયેલ વેચાણ દસ્તાવેજ થી સંયુક્ત રીતે વેચાણ રાખેલ છે. ત્યારબાદ દક્ષા જયંતીલાલ ચોટલીયાનું તા ૦૨/૦૨/૨૦૨૩ ના રોજ અવસાન થયેલ છે. દક્ષા જયંતીલાલ ચોટલીયાનું અવસાન થયેલ હોઈ ઉપરોક્ત મિલકત જયંતીલાલ બાબુલાલ ચોટલીયા તેમજ ગુજરનાર દક્ષા જયંતીલાલ ચોટલીયા ના સીધી લીટી ના વારસદારો ૧) વૈશાલી જયંતીભાઈ ચોટલીયા ૨) સ્વેતા જયંતીભાઈ ચોટલીયા નાઓના સંયુક્ત હિસ્સે આવેલ છે, અને તેઓ જણાવે છે કે સ્વ. દથા જયંતીલાલ ચોટલીયા ના ઉપરોક્ત અમો વારસદાર સિવાય અન્ય કોઈ વ્યક્તિ વંશ, વાલી, વારસો નથી. સદરહુ મિલકત સ્વ દક્ષા જયંતીલાલ ચોટલીયા ના ઉપરોક્ત વારસદારોના નામ, અંબા ટાઉનશીપ સેક્ટર-૩, રેસીડન્સ વેલ્કેર એસોસીએશનમાં સદરહુ ફલેટમાં સભાસદ તરીકે ટ્રાન્સફર કરવાની માંગણી કરેલ છે, તથા સદરહું મિલ્કત તેઓની કુલ સ્વતંત્ર, માલિકી, કબ્જા, ભોગવટાની આવેલી હોવોનું જણાવી તેઓ અમારી પાસેથી ટાઈટલ ક્લીયર સર્ટીકીકેટ ની. માંગણી કરે છે. જેથી આ વિશે કોઈને કોઈપણ પ્રકારનો વાંધો, તકરાર હોય ખથવા સદરહુ મિલ્કત પર કોઈ વ્યકિત કે સંસ્થાનો કોઈપણ જાતનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દર, દાવો, ખોરાકી-પોપાકી કે કોઈપણ જાતનો અધિકાર વેચાણથી, બાનાખતથી, ગીરો, બલીસ, લીધનથી અથવા કોઈપણ જાતના બોજા, ચાર્જ હોય તો તેની જાણ અમોને આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે રજી. પોસ્ટ એ.ડી. થી લેખિતમાં અથવા રૂબરૂમાં અમારા નીચે જણાવેલ સરનામે કરશો. જો તેમ કરવામાં કસુર થશે તો તેઓએ પોતાનો હક્ક, હિત, હિસ્સો એમારા અસીલની તરફેલમાં જવા દીધેલ છે/વેવ કરેલ છે, તેમ ગણી મુદત વિત્યે ઉપરોક્ત વારસદારોના નામ સ્વ. દક્ષા જયંતીલાલ ચોટલીયા ના વારસદાર તરીકે. ૧)સ્વેતા જયંતીલાલ યોટલીયા ૨) વૈશાલી જયંતીલાલ ચોટલીયા અંબા ટાઉનશીપ સેક્ટર-૩, રેસીડન્સ વેલ્ફેર એસોસીએશનના રેકર્ડમાં સદરહુ ફલેટના સભાસદ તરીકે દાખલ કરવામાં આવશે અને અમારા અસીલ ને ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટઆપી દેવામાં આવશે . ત્યારબાદ કોઈની કોઈપણ જાતની તકરાર ચાલશે નહી. જેની નોંધ લેશો

> હરેશ એમ વિકલાણી (G/2688/2001) (એફવાફટ) સરનામું: ૯૧૦, ઇલાઇટ બિલ્ડીંગ, કારગીલ પેટ્રોલ પંપ પાસે, સોલા , અમદાવાદ -મો. ૯૪૨૬૨૨૯૦૨૭

મધુવીર કોમ 18 નેટવર્ક લિમિટેડ

રજી. ઓફિસ : ઓફિસ નં. # 812 આનંદ મંગલ - ૩, કોર હાઉસની સામે, હીરાબાગ પાસે, રાજનગર ક્લબ પાસે, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦૦૦ દ CIN:L24230GJ1995PLC026244 || Phone: 9773151363 Email:tohealpharmachem@gmail.com || Website: www.mcom18.com એકસ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ નં.૧/૨૦૨૪-૨૫ની

નોટિસ, રીમોટ ઈ-વોટિંગની માહિતી આથી નોટિસ આપવામાં આવે છે કે મધુવીર કોમ ૧૮ નેટવર્ક લિમિટેડના સભ્યોની ૧લી એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ ("૧લી EGM") **બુધવાર, ૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે** યોજાશે. ૧લી EGM ની નોટિસમાં નિર્ધારિત કર્યા મુજબ, વ્યવસાયનો વ્યવહાર કરવા.

કંપનીએ સોમવાર, ઓગસ્ટ ૧૨, ૨૦૨૪ના રોજ ૧લી EGM બોલાવવાની નોટિસ ઈ-મેલ દ્વારા જેમના ઈ-મેલ આઈડી કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સકર એજન્ટ મેસર્સ પૂર્વ શેરજિસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ / ડિપોઝિટરી સહભાગી(ઓૂ) સાથે નોંધાયેલા છે તેમને મોકલી છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલય સહાનાગા(આ) સાથે નાવાયલા છે તમને માકલા છે. કાપારટ બાબતાના મંત્રાલય દ્વારા ૦૮ એપ્રિલ, ૨૦૨૦ના રોજના પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, મંત્રાલય દ્વારા જારી કરાયેલ તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૨૦ના પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર કોર્પોરેટ બાબતોના પરિપત્ર નં. ૨૦/૨૦૨૦ તારીખ ૦૫ મે, ૨૦૨૦, પરિપત્ર નં. ૨૨/૨૦૨૦ તારીખ ૧૫ જૂન, ૨૦૨૦, પરિપત્ર નં. ૦૫/૨૦૦૧ તારીખ ૧૩ જાન્યુઆરી, ૨૦૨૦ પરિપત્ર નં. ૧૦૫/૨૦૨૧ તારીખ ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧, પરિપત્ર ને. ૧૦/૨૦૨૧ તારીખ ૨૩ જૂન, ૨૦૨૧ પરિપત્ર ને. ૧૧/ ૨૦૨૧, તારીખ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧, પરિપત્ર ને. ૦૨/૨૦૨૧ અને સામાન્ય તારીખ ૦૨/૨૦૨૧ પરિપત્ર નં. ૧૧/૨૦૨૨ તારીખ ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨ ("MCA પરિપત્ર") અને પરિપત્ર નં. SEB/HO/CFD/CMD1/CIR/P/2020/79 તારીખ (TMCA પારપત્ર') અને પારપત્ર ને. SEBIHO/CFD/CMD1/CIR/P/202079 તારીખ ૧૨મે, ૨૦૨૦ અને પરિપત્ર નં. SEBIHO/CFD /CMD2/CIR/P/2021/11 તારીખ ૧પ જ્ઞન્યુઆરી, ૨૦૨૧, પરિપત્ર નંબર SEBIHO/DDHS/DDHS_Div2/P/CIR/2022079 તારીખ ૩જી જૂન, ૨૦૨૨ અને SEBIHO/CFD/PoD-2/ P/CIR/2023/4 તારીખ પ જ્ઞન્યુઆરી, ૨૦૨૩ સિક્ચોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા જારી કરાયેલ ("પરિપત્રો"). EGM બોલાવવાની નોટિસ કંપનીની વેબસાઇટ https://www.mcom18.com/ પર, સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ એટલે કે BSE https://www.mcom18.com/ પર, સ્ટાક અક્સવજના વખસાઇટ અટલ ક BSE (લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઈન્ડિયા) (લિમિટેડ (CDSL)ની વેબસાઇટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે. કંપનીની ૧લી EGMના હેતુ માટે શેરધારકોની ઓળખ અધિનિયમની કલમ ૧૦૮ અને કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૦ ની જોગવાઈઓને અનુરૂપ અને સિક્ચોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ એક ઈન્ડિયાના નિયમન ૪૪ (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ અને ડિસ્ક્લોઝર જરૂરીયાતો) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના સભ્યો છે.EGM નોટિસમાં દર્શાવ્યા મુજબ તમામ ઠરાવો પર cosા દ્વારા પૂરી પાડવામાં આવતી ઈ-વોર્ટિંગ સેવાઓ દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે તેમનો વોટ આપવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. સભ્યોના વોર્ટિંગ અધિકારો બુધવાર, ૨૮ ઓગસ્ટ, ૨૦૨૪ ("કટ-ઓફ તારીખ") ના રોજ કૃંપનીની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીમાં તેમના દ્વારા રાખવામાં આવેલા ઇક્વિટી શેરના પ્રમાણમાં હશે.

રિમોટ ઈ-વોટિંગનો સમયગાળો શનિવાર, ઑગસ્ટ ૩૧, ૨૦૨૪ના રોજ ારમાટ ઇ-વાાટ અના સમયગાળા શાનવાર, આગસ્ટ ઉપ, ૨૦૨૪ના રાજ સવારે ૦૯:૦૦ વાગ્યે શરૂ થશે અને મંગળવાર, સપ્ટેમ્બર ૦૩, ૨૦૨૪ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન, સભ્યો ઇલેક્ટ્રોનિક રીતે તેમનો વોટ આપી શકે છે. ત્યાર બાદ સીડીએસએલ દ્વારા રીમોટ ઈ-વોટિંગ મોડચુલને અક્ષમ કરવામાં આવશે. જે સભ્યો EGM માં હાજર રહેશે અને રિમોટ ઈ-વોટિંગ દ્વારા ઠરાવો પર પોતાનો વોટ આપ્યો નથી અને અન્યથા આમ કરવાથી પ્રતિબંધિત નથી, તેઓ EGM દરમિયાન બેલેટ પેપર સિસ્ટમ દ્વારા વોટ આપવાને પાત્ર રહેશે.

જે સભ્યોએ EGM પહેલા રિમોટ ઈ-વોટિંગ દ્વારા પોતાનો વોટ આપ્યો છે તેઓ પણ EGM માં હાજરી આપી શકે છે/ ભાગ લઈ શકે છે પરંતુ તેઓ ફરીથી તેમનો વોટ આપવા માટે હકદાર નથી.

ડીમટીરિયલાઈઝુડ મોડ તથા ફિઝિકલ મોડમાં શેર ધરાવતા સભ્યો દ્વારા ઈજીએમમાં રિમૌટ ઈ-વોટિંગ અને વોટિંગ કરવાની રીત અને જે સભ્યોએ તેમના ઈમેલ એડ્રેસની નોંધુણી કૂરાવી નથી તેમના ઈ-મેલ એડ્રેસની નોંધુણી કરવાની પ્રક્રિયા ઇજીએમની નોટિસમાં આપવામાં આવી છે.

કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેર મેળવે છે અને કંપની દ્વારા નોટિસ ઈલેક્ટ્રોનિક રીતે મોકલવામાં આવ્યા પછી કંપનીના સભ્ય બને છે અને કટ-ઓફ તારીખે શેર ધરાવે છે; હેલ્પડેસ્ક helpdesk.evoting@cdslindia.com પર વિનૃતી મોકલીને લોગ ઇન્ આઇડી અને પાસવર્ડ મેળવી શકે છે. જો કે જો તે/ તેણી પહેલાથી જ રિમોટ ઈ-વોટિંગ માટે cos∟ સાથે નોંધાયેલ હોય, તો તે/ તેણી વોટ આપવા માટે તેના/ તેણીના હાલના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકે છે.

જો સભ્ય(સદસ્યો)એ કંપની / ડિપોઝિટરી સાથે તેમના ઈ-મેલ સરનામાંની નોંધણી કરાવી ન હોય, તો કૃપા કરીને વાર્ષિક અહેવાલ મેળવવા માટે ઈ-મેલ સર્નામું રજીસ્ટર કર્વા અને ઈ-વોટિંગ માટે લોગિન વિગતો મેળવવા માટે નીંચેની સૂચનાઓને અનુસરો -

એ) ફિઝિકલ મોડમાં શેર ધરાવતા સભ્યો માટે - કૃપા કરીને જરૂરી વિગતો જેમ કૃ ફોલિયો નંબર, શેરધારકનું નામ tohealpharmachem@gmail.com પર ઈ-મેલ દ્વારા પ્રદાન કરો

બી) ડીમેટ મોડમાં શેર ધરાવતા સભ્યો તેમના સંબંધિત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનો સંપર્ક કરીને અથવા ઈ-મેલ totohealpharmachem@gmail.com દ્વારા તેમનું ઈ-મેલ આઈડી રજીસ્ટર કરાવી શકે છે.

જો તમારી પાસે ઈ-વોટિંગ સંબંધિત કોઈ પ્રશ્નો હોય, તો સભ્યો મદદ વિભાગ જા તમારા પાસ ઇ-વાટિંગ સંબાધત કાઇ પ્રશ્ના હાય, તા સભ્યા મદદ વિભાગ હેઠળ www.evolingindia.com પર ઉપલબ્ધ વારંવાર પૂછાતા પ્રશ્ને (FAQs) અને ઈ-વોટિંગ મેન્યુઅલનો સંદર્ભ લઈ શકે છે અથવા helpdesk.evoling@ccslindia.com પર ઈ-મેલ કરી શકે છે અથવા શ્રી રાકેશ દલવી, અધિકૃત પ્રતિનિધિ, સેન્ટૂલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ, એ વિંગ, રપમો માળ, મેરેથોન ફ્યુચરેક્સ, મકતલાલ મિલ કમ્પાઉન્ડ્સ, એન એમ જોશી માર્ગ, લોઅર પરલ (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૧૩ નો સંપક કરો અથવા ૧૮૦૦૨૨૫૫૩૩ પર કૉલ કરો. મધુવીર કોમ ૧૮ નેટવર્ક લિ. વતી સહી/- **હિમાની વોરા**

કંપની સેક્રેટરી અને અનુપાલન અધિકારી મેમ્બર નં. : A73750 સ્થળ : અમદાવાદ તારીખ: ૧૨-૦૮-૨૦૨૪

STOVEC INDUSTRIES LIMITED

Regd. Office: N.I.D.C., Near Lambha Village, Post: Narol, Ahmedabad - 382 405, Gujarat, India. Website: www.stovec.com, e-mail: secretarial@stovec.com, CIN: L45200GJ1973PLC050790 Tel: +91(0)79 - 6157 2300, Fax: +91(0)79 - 2571 0406

Statement of unaudited financial results for the quarter and half year ended June 30, 2024

					(R	s. in Million
		Quarter ended			Half year ended	
Particulars	30/06/2024	31/03/2024	30/06/2023	30/06/2024	30/06/2023	31/12/2023
N 0.550.750.55	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
Total income from operations (net)	612.03	599.57	572.51	1,211.60	1,016.46	2,072.56
Net Profit for the periods/year (before tax, Exceptional and/or Extraordinary items) Net Profit for the periods/year before tax (after Exceptional and/or Extraordinary)	47.55	63.33	26.42	110.88	58.41	114.19
items)	47.55	63.33	26.42	110.88	58.41	114.19
Net Profit for the periods/year after tax (after Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for the periods / year [Comprising Profit (after tax) and	35.91	47.50	20.16	83.41	44.63	90.37
Other Comprehensive Income (after tax)]	36.12	46.53	20.15	82.65	43.81	89.44
Paid up Equity Share Capital (Face value per share Rs. 10)	20.88	20.88	20.88	20.88	20.88	20.88
Other equity (excluding revaluation reserves) as at balance sheet date Earnings per share of Rs. 10 each (not annualised for the quarters):			78		-	1,379.79
a) Basic (Rs.):	17.20	22.75	9.65	39.95	21.37	43.28
h) Diluted (Rs.)	17.20	22.75	9.65	30.05	21 37	43.28

(1) The above is an extract of the detailed format of unaudited financial results for the quarter and half year ended June 30, 2024 filed with the Stock Exchange which prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules 2015 (as amended) (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the extent applicable.

(2) In accordance with the requirement of Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Statutory Auditors have performed a limited review of Company's unaudited financial results for the quarter and half year ended June 30, 2024. The full format of unaudited financial results are available on the Company's Website, www.stovec.com and on the BSE website, www.bseindia.com

Shailesh Wani

Managing Director (DIN: 06474766)







Place: Ahmedabad

Date: August 12, 2024













